



પોલીસ કમિશનરની કચેરી, સુરત શહેર.  
 પોલીસ ભવન, અઠવાલાઇન્સ, સુરત શહેર-૩૮૫૦૦૧  
 વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૯૧૧૦  
 કંદ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૯૩૦૪  
 e-mail : special.cp.sur@gmail.com



### :: જાહેરનામું ::

#### :: ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭(૩) અન્વયે કાઢેલ હુકમ ::

કમાંક:એસ.બી./ ચાર કરતા વધુ વ્યક્તિ લેગા થવા ઉપર/ ૮૩ /૨૦૨૧.

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019)ને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગાનાઇઝેશન) ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ના ઝડપી સંકમણને ધ્યાને લેતા તકેદારીના ભાગ તથા સુરત શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. જેથી કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારુ સુરત પોલીસ કમિશરેટની હદ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાસ્તે, હું અધ્યક્ષમાર તોમર (આઇ.પી.એસ.) પોલીસ કમિશર, સુરત શહેર, ગુજરાત પોલીસ એકટની કલમ ૩૭ (૩) અન્વયે મને મળેલ સત્તાની રૂપે આથી હુકમ કરું છું કે,

### :: પ્રતિબંધીત ફુત્યો ::

સુરત પોલીસ કમિશરેટ વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં. તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં અને કોઈ પણ જાતની સભા-સરધસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

### :: અપવાદ ::

આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.

### :: અમલવારીનો સમય તથા વિસ્તાર. ::

સુરત શહેર પોલીસ કમિશર હુકમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૧૪/૦૪/૨૦૨૧ ના ક.૦૬-૦૦ થી તા.૨૮/૦૪/૨૦૨૧ ના ક.૨૪-૦૦ વાગ્યા સુધી હુકમનો અમલ કરવાનો રહેશે.

### :: શિક્ષા ::

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ (૩) મુજબ શિક્ષાને પાત્ર થશે

. આ હુકમ અન્વયે સુરત કમિશરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે જી.પી.એક્ટ-કલમ ૧૩૫ (૩) મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

### :: જાહેર વિજાપ્તિ ::

હું આથી આદેશ આપું છું કે, આ હુકમ ની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારમાં સહેલાઇ થી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોટાડીને લાઉંસ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાનપત્રો અને આકાશવાણી અને ફુરદર્શન કેન્દ્ર ઉપરથી કરાવવી.

આજ તારીખ :- ૧૨/૦૪/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કો કરી આપેલ છે.



(અધ્યક્ષમાર તોમર)  
 પોલીસ કમિશર,  
 સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશરશ્રી, સેકટર-૧, ૨ સુરત શહેર.
- (૨) અધિક પોલીસ કમિશરશ્રી, ટ્રાફિક અને કાઇમ સુરત શહેર.
- (૩) નાયબ પોલીસ કમિશરશ્રી, તમામ, સુરત શહેર.
- (૪) મદદનીશ પોલીસ કમિશરશ્રી તમામ, સુરત શહેર.
- (૫) તમામ પો.સ્ટે.ઇન્યાર્જશ્રીઓ, સુરત શહેર. (નકલો ચોટાડી લાઉંડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારુ)
- (૬) તમામ શાખા ઇન્યાર્જશ્રીઓ, સુરત શહેર.
- (૭) કંટ્રોલ ઇન્યાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ એન્લોને એક-એક નકલ આપવી).

સાચિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સાચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઇન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેઝ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઇન્ટે.) સુરત રીજિયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જુલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિદ્ધ કરવા સારુ).
- (૧૩) પો.ઇન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજુસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજુસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત.
- (૧૬) રજુસ્ટ્રારશ્રી, ચીફ જયુડીશ્યલ મેજુ.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એક્ઝિક્યુટીવ મેજુ.શ્રી, સુરત શહેર. (નાનપુરા બહુમાળી સુરત)
- (૧૮) સબ ડીવીઝનલ મેજુ.શ્રી, સીટી પ્રાંત. ( જુલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )
- (૧૯) સંયુક્ત માહીતી નિયામકશ્રી, સુરત (સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા ફુરદર્શન કેન્દ્રમાં પ્રસિદ્ધ કરવા સારુ)